

Seat No : _____

SARDAR PATEL UNIVERSITY**NOVEMBER – DECEMBER : 2019 EXAMINATION, B.COM. SEMESTER : III****SATURDAY, 30/11/2019****EVENING SESSION TIME : 2.00 PM TO 4.00 PM****SUBJECT CODE : UB03SCOM23****REASONING ABILITY - I****TOTAL MARKS : 60**

- Q-1 (A) What is reasoning ability? Explain the types of reasoning ability. [07]
 Q-1 (B) What is Aptitude test? Explain the importance of Aptitude test. [08]

OR

- Q-1 List out public exam. Explain any two public exam. [15]
 Q-2, 3 & 4 **Each question is compulsory & carry one marks.** [45]

- (1) solve as per the direction given above
- | | |
|---------------|---------------|
| (A) Passenger | (B) Passenger |
| (C) Pasanger | (D) Pesanger |
- (2) Sentence formation : (1) was (2) and (3) Suresh (4) Kind (5) loving
- | | |
|-----------|-----------|
| (A) 31425 | (B) 54213 |
| (C) 34251 | (D) 15243 |
- (3) QPO, NML, KJI, _____, EDC
- | | |
|---------|---------|
| (A) HGF | (B) CAB |
| (C) JKL | (D) GHI |
- (4) WAN:COLOUR
- | | |
|-------------------------|------------------------|
| (A) Corpulent : weight | (B) Insipid : flavour |
| (C) Pallid : complexion | (D) Enigmatic : puzzle |
- (5) Which word does NOT belong with the others?
- | | |
|----------------|----------------|
| (A) Mozzarella | (B) Cheddar |
| (C) Gouda | (D) mayannaise |
- (6) Rohan & Rohit are twin brothers, but they do not look
- | | |
|------------|---------------|
| (A) Unique | (B) Different |
| (C) Likely | (D) Alike |
- (7) Veena who is the sister-in-law of Ashok, is the daughter-in-law of Kalyani. Dheeraj is the father of Sudeep who is the only brother of Ashok. How Kalyani is related to Ashok?
- | | |
|-------------------|-------------------|
| (A) Mother-in-law | (B) Aunt |
| (C) Wife | (D) None of these |
- (8) JOSEPH : FKOALD
GEORGE : ?
- | | |
|------------|------------|
| (A) HAKNCA | (B) CAKNCA |
| (C) CBKNCA | (D) CALNCA |
- (9) Candid : Indirect
honest : ?
- | | |
|--------------|----------------|
| (A) Frank | (B) Wicked |
| (C) Truthful | (D) Untruthful |
- (10) Exercise is to gym as eating is to
- | | |
|-------------|----------------|
| (A) Food | (B) Dieting |
| (C) Fitness | (D) Restaurant |

P.T.O.

(11) 5, 10, 20, 40, 80.....?

(A) 90

(B) 160

(C) 180

(D) 85

For Question 12 & 13 :

Six friends P, Q, R, S, T and U are sitting around the hexagonal table each at one corner and are facing the center of the hexagonal. P is second to the left of U. Q is neighbour of R and S. T is second to the left of S.

From the above Information find out answer :

(12) Who is the fourth person to the left of Q?

(A) P

(B) U

(C) R

(D) Data inadequate

(13) Which of the following are the neighbors of P?

(A) U & P

(B) T & R

(C) U & R

(D) Data inadequate

(14) $B + M - H$, from the following which number is appropriate.

(A) 10

(B) 7

(C) 15

(D) 12

From the following option, select answers: (for question no. 15 to 16)

(A) If the statement is fact

(B) If the statement is suggestion

(C) If the statement is opinion

(D) If the statement is Prejudice

(15) Life is a journey from womb to tomb.


(A) (B) (C) (D)

(16) It is better to be late than the Late.

(A) (B) (C) (D)

For question 17 to 21

The bar graph given below shows the sales of books (in thousand number) from six branches of a publishing company during two consecutive years 2000 and 2001.



Sales of Books (in thousand numbers) from Six Branches - B1, B2, B3, B4, B5 and B6 of a publishing Company in 2000 and 2001.

(17) What is the ratio of the total sales of branch B2 for both years to the total sales of branch B4 for both years?

(A) 2:3

(B) 3:5

(C) 4:5

(D) 7:9

- (18) Total sales of branch B6 for both the years is what percent of the total sales of branches B3 for both the years?
- (A) 68.54% (B) 71.11%
(C) 73.17% (D) 75.55%
- (19) What percent of the average sales of branches B1, B2 and B3 in 2001 is the average sales of branches B1, B3 and B6 in 2000?
- (A) 75% (B) 77.5%
(C) 82.5% (D) 87.5%
- (20) What is the average sales of all the branches for the year 2000?
- (A) 73 (B) 80
(C) 83 (D) 88
- (21) Total sales of branches B1, B3 and B5 together for both the years is?
- (A) 250 (B) 310
(C) 435 (D) 560

For question 22 to 26

Following table gives the percentage of marks obtained by seven students in six different subjects in an examination.


The Numbers in the Brackets give the Maximum Marks in Each Subject.

Student	Subject (Max. Marks)					
	Maths	Chemistry	Physics	Geography	History	Computer Science
	(150)	(130)	(120)	(100)	(60)	(40)
Ayush	90	50	90	60	70	80
Aman	100	80	80	40	80	70
Sejal	90	60	70	70	90	70
Rohit	80	65	80	80	60	60
Muskan	80	65	85	95	50	90
Tanvi	70	75	65	85	40	60
Tarun	65	35	50	77	80	80

- (22) What are the average marks obtained by all the seven students in physics?
- (A) 77.26 (B) 89.14
(C) 91.37 (D) 96.11
- (23) The number of students who obtained 60% and above marks in all subjects is?
- (A) 1 (B) 2
(C) 3 (D) None of these
- (24) What was the aggregate of marks obtained by Sejal in all the six subject?
- (A) 409 (B) 419
(C) 429 (D) 449
- (25) In which subject is the overall percentage the best?
- (A) Maths (B) Chemistry
(C) Physics (D) History
- (26) What is the overall percentage of Tarun?
- (A) 52.5% (B) 55%
(C) 60% (D) 63%

Instruction for question no. 27 to 30 : In a school the periodical examination are held every second month. In a session during April 2001 - March 2002, a student of Class IX appeared for each of the periodical exams. The aggregate marks obtained by him in each periodical exam are represented in the line-graph given below.

Marks Obtained by student in Six Periodical Held in Every Two Months During the Year in the Session 2001 - 2002.



- (27) In which periodical exams did the student obtain the highest percentage increase in marks over the previous periodical exams ?
- (A) June, 01 (B) August, 01
(C) Oct, 01 (D) Dec, 01
- (28) The total number of marks obtained in Feb. 02 is what percent of the total marks obtained in April 01 ?
- (A) 110% (B) 112.5%
(C) 115% (D) 116.5%
- (29) What is the percentage of marks obtained by the student in the periodical exams of August, 01 and Oct, 01 taken together ?
- (A) 73.25% (B) 75.5%
(C) 77% (D) 78.75%
- (30) What are the average marks obtained by the student in all the periodical exams during the last session ?
- (A) 373 (B) 379
(C) 381 (D) 385

Instruction for Question No. 31 to 35 : In the following questions choose the word which is the exact OPPOSITE of the given words.

- (31) INDISCREET
- (A) Reliable (B) Honest
(C) Prudent (D) Stupid
- (32) FAMILIAR
- (A) Unpleasant (B) Dangerous
(C) Friendly (D) Strange
- (33) TANGIBLE
- (A) Ethereal (B) Concrete
(C) Actual (D) Solid
- (34) LOVE
- (A) Villainy (B) Hatred
(C) Compulsion (D) Force

(35) FAMOUS

- (A) Disgraced
(C) Evil

- (B) Unknown
(D) popular

Instruction for Question No. 36 to 40 : In the following questions choose the word which best expresses the meaning of the given word.

(36) DEIFY

- (A) Flatter
(C) Worship

- (B) Challenge
(D) Face

(37) CANDID

- (A) Apparent
(C) Frank

- (B) Explicit
(D) Bright

(38) INFREQUENT

- (A) Never
(C) Rare

- (B) Usual
(D) Sometimes

(39) RESTRAINT

- (A) Hindrance
(C) Obstacle

- (B) Repression
(D) Restriction

(40) HARBINGER

- (A) Messenger
(C) Forerunner

- (B) Steward
(D) Pilot

Instruction for Question No. 41 to 45 : Read the following passage and answer the following questions.

What should be the objective of life whether money or principles. It is really difficult for a well educated, intellectual or brave person to make money the chief object of his thoughts. No doubt all the healthy people like their dinners, but their dinner is not the main object of their lives. Also, not doubt, all healthy-minded people like to make money, like to have it and enjoy the sensation of having it. But there is something better than money. For instance, doctors not doubt, like fees, yet if they are brave and well educated, the entire object of their lives is not fees. They on the whole, desire to cure the sick; and if they are good doctors and the choice were fairly put to them, would rather cure their patient and lose their fees than kill him and get it. So of a good soldier, who mainly wished to do his fighting well. He is glad of the pay, though his main notion of life is to win battle, not to be paid for winning them. Similarly, the clergyman's object is essentially to baptize and preach, not to be paid for preaching. This is how it is also true with all the other brave and rightly trained men; their work comes first, the payment later, though very important but secondary.

(41) What is the principal object of the lives of brave intellectual and well-educated people?

- (A) To make money
(C) To work with devotion
- (B) To enjoy
(D) Manage the leisurely objects

(42) According to the passage, if a doctor is brave and well educated, and a choice was put to him, what would he choose?

- (A) Cure the patient and lose his fees
(C) Any of these depending on circumstances
- (B) Kill the patient and get his fees
(D) The passage is silent on this.

(43) A suitable title of the passage may be

- (A) Money making, the chief object of the life
(C) Importance of Thought
- (B) Devotion to work
(D) Money, not the Chief object of Life

(44) One may infer from the paragraph that

- (A) Brave person like to make money
(C) Brave person like to work first than their fees
- (B) Brave persons like to win others
(D) None of these

(45) A person would always rank work superior to the money if he is

- (A) Brave and intellectual
(C) Rightly trained
- (B) Well educated
(D) All the above

Seat No : _____

SARDAR PATEL UNIVERSITY**NOVEMBER – DECEMBER : 2019 EXAMINATION, B.COM. SEMESTER : III****SATURDAY, 30/11/2019****EVENING SESSION TIME : 2.00 PM TO 4.00 PM****SUBJECT CODE : UB03SCOM23****REASONING ABILITY - I**

(48-10-1)

TOTAL MARKS : 60

પ્રશ્ન-૧ (અ) રીઝનીંગ એબીલીટી એટલે શું? તેના પ્રકારો સમજાવો. [07]

પ્રશ્ન-૧ (બ) મનોવલણો એટલે શું? મનોવલણોનું મહત્વ સમજાવો. [08]

અથવા

પ્રશ્ન-૧ જાહેર પરીક્ષાની યાદી બનાવી. ગમે તે બે જાહેર પરીક્ષા વિશે સમજાવો. [15]

પ્રશ્ન-૨, ૩ અને ૪ દરેક પ્રશ્ન ફરજિયાત છે તેમજ દરેકનો એક ગુણ છે. [45]

૧. સારી સ્પેલિંગ શોધો :

- | | |
|---------------|---------------|
| (અ) Pessanger | (બ) Passenger |
| (ક) Pasanger | (ડ) Pesanger |

૨. વાક્ય ગોઠવો : (1) was (2) and (3) Suresh (4) kind (5) loving

- | | |
|-----------|-----------|
| (અ) 31425 | (બ) 54213 |
| (ક) 34251 | (ડ) 15243 |

૩. QPO, NML, KJI, _____, EDC

- | | |
|---------|---------|
| (અ) HGF | (બ) CAB |
| (ક) JKL | (ડ) GHI |

૪. વાન : રંગ

- | | |
|------------------|-----------------------|
| (અ) ભ્રષ્ટ : વજન | (બ) નિવિર્વાદ : સ્વાદ |
| (ક) પેલિડ : રંગ | (ડ) ભેદી : કોચડો |

૫. કયો એક શબ્દ બીજા શબ્દ સાથે સંબંધિત નથી?

- | | |
|-------------|-------------|
| (અ) મોઝરેલા | (બ) ચેક્કાર |
| (ક) ગોડા | (ડ) માયોનીઝ |

૬. રોહન અને રોહિત જુડવા ભાઈઓ છે, પણ તેઓ દેખાવે..... નથી.

- | | |
|------------|---------------|
| (અ) અનન્ય | (બ) જુદા-જુદા |
| (ક) સંભવિત | (ડ) સરખાં |

૭. વીણા કે જે અશોકની ભાભી છે, જે કલ્યાણીની પુત્રવધુ છે. ધીરજ એ સુદીપના પિતા છે. જે એક માત્ર અશોકના ભાઈ છે. તો કલ્યાણી અશોક સાથે કઈ રીતે સંબંધિત છે?

- | | |
|-----------|-----------------------|
| (અ) સાસુ | (બ) કાકી |
| (ક) પત્ની | (ડ) આમાંથી એક પણ નહિ. |

૮. JOSEPH : FKOALD :: GEORGE : ?

- | | |
|------------|------------|
| (અ) HAKNCA | (બ) CAKNCA |
| (ક) CBKNCA | (ડ) CALNCA |

૯. નિખાલસ : અપ્રમાણિક :: પ્રમાણિક : ?

- | | |
|--------------|-------------|
| (અ) નિષ્કપટ | (બ) પાંપી |
| (ક) સાચાપણું | (ડ) જુઠાણું |

૧૦. કસરત એ જીમને સંબંધિત છે, તો તેવી જ રીતે જમવું તે

- | | |
|---------------|-----------------|
| (અ) ખોરાક | (બ) પરેજી પાળવી |
| (ક) તંદુરસ્તી | (ડ) રેસ્ટોરન્ટ |

૧૧. 5, 10, 20, 40, 80, ...?

(અ) 90

(બ) 160

(ક) 180

(ડ) 85

પ્રશ્ન નં. ૧૨ અને ૧૩ માટે નીચે આપેલી માહિતીના આધારે જવાબ આપવો.

P, Q, R, S, T અને U છ મિત્રો એક ષષ્ઠકોણ ટેબલની ફરતે મધ્યે નજર રાખીને ષષ્ઠકોણમાં બેઠેલાં છે. P એ U ની બીજા ક્રમકે ડાબી બાજુ બેઠેલ છે. Q એ R અને S ના પાડોશી છે. T એ S ની બીજા ક્રમકે ડાબી બાજુએ છે.

૧૨. Q ની ડાબી બાજુએ ચોથા ક્રમકે કોણ છે?

(અ) P

(બ) U

(ક) R

(ડ) અપૂરતી માહિતી

૧૩. P ની વિરુદ્ધ દિશામાં કોણ બેઠેલ છે?

(અ) R

(બ) Q

(ક) T

(ડ) S

૧૪. B + M - H માટે કયો નંબર યોગ્ય છે ?

(અ) ૧૦

(બ) ૭

(ક) ૧૫

(ડ) ૧૨

પ્રશ્ન નં. ૧૫ અને ૧૬ માટે નીચે આપેલી માહિતીના આધારે જવાબ આપવો.

(અ) જો વિધાન એક હકીકત હોય તો

(બ) જો વિધાન એક સલાહ હોય તો

(ક) જો વિધાન એક અભિપ્રાય હોય તો

(ડ) જો વિધાન એક પૂર્વગ્રહ હોય તો


૧૫. જીંદગી એ માતાના ગર્ભથી કબર સુધીની સફર છે.

(અ) (બ) (ક) (ડ)

૧૬. સ્વર્ગસ્થ થવું તેના કરતાં મોડું પડવું એ સારું.

(અ) (બ) (ક) (ડ)

પ્રશ્ન : ૧૭ થી ૨૧ માટે નીચેના બારચાર્ટમાં વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૧ માં એક પ્રકાશક કંપનીની છ શાખાઓનું પુસ્તકોનું વેચાણ (હજાર એકમમાં) દર્શાવે છે :



૧૭. આપેલા બન્ને વર્ષમાં શાખા B2 અને B4 નું કુલ વેચાણનું પ્રમાણ કેટલું છે તે શોધો.

(અ) 2 : 3

(બ) 3 : 5

(ક) 4 : 5

(ડ) 7 : 9

૧૮. શાખા B6 નું બન્ને વર્ષનું કુલ વેચાણ અને શાખા B3 નું બન્ને વર્ષનું કુલ વેચાણના કેટલા ટકા થશે?
- (અ) 68.54% (બ) 71.11%
- (ક) 73.17% (ડ) 75.55%
૧૯. વર્ષ ૨૦૦૧ ના B1, B2 અને B3 શાખાનું સરેરાશ વેચાણના કેટલા ટકા તે વર્ષ ૨૦૦૦ ના શાખા B1, B3 અને B6 નું થઈ શકે?
- (અ) 75% (બ) 77.5%
- (ક) 82.5% (ડ) 87.5%
૨૦. વર્ષ ૨૦૦૦ ના તમામ શાખાનું સરેરાશ વેચાણ કેટલું ?
- (અ) ૭૩ (બ) ૮૦
- (ક) ૮૩ (ડ) ૮૮
૨૧. બન્ને વર્ષનું શાખા B1, B3 અને B5 નું કુલ કેટલું વેચાણ ?
- (અ) ૨૫૦ (બ) ૩૧૦
- (ક) ૪૩૫ (ડ) ૫૬૦

પ્રશ્ન : ૨૨ થી ૨૬ માટે : નીચેનું કોષ્ટક એક પરીક્ષામાં ૭ વિદ્યાર્થીઓએ જુદા-જુદા ૬ વિષયોમાં મેળવેલા ટકાવારી ગુણ દર્શાવે છે.

Student	Subject (Max. Marks)					
	Maths	Chemistry	Physics	Geography	History	Computer Science
	(150)	(130)	(120)	(100)	(60)	(40)
Ayush	90	50	90	60	70	80
Aman	100	80	80	40	80	70
Sejal	90	60	70	70	90	70
Rohit	80	65	80	80	60	60
Muskan	80	65	85	95	50	90
Tanvi	70	75	65	85	40	60
Tarun	65	35	50	77	80	80

૨૨. ફીજીક્સ વિષયમાં તમામ સાત વિદ્યાર્થીઓએ કેટલા સરેરાશ ગુણ પ્રાપ્ત કરેલા છે ?
- (અ) ૭૭.૨૬ (બ) ૮૮.૧૪
- (ક) ૮૧.૩૭ (ડ) ૮૬.૧૧
૨૩. તમામ વિષયમાં ૬૦% ગુણ પ્રાપ્ત કરેલ અને ૬૦% થી વધારે ગુણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો.
- (અ) ૧ (બ) ૨
- (ક) ૩ (ડ) એકપણ નહિ
૨૪. સેજલે છ વિષયમાં કુલ કેટલા ગુણ પ્રાપ્ત કરેલ છે ?
- (અ) ૪૦૮ (બ) ૪૧૮
- (ક) ૪૨૮ (ડ) ૪૪૮
૨૫. કયા વિષયમાં કુલ શ્રેષ્ઠ ટકા છે ?
- (અ) મેથ્સ (બ) કેમેસ્ટ્રી
- (ક) ફીઝિક્સ (ડ) ઇતિહાસ (હિસ્ટ્રી)

૨૬. તરૂણના કુલ કેટલા ટકા છે?

(અ) ૫૨.૫%


(બ) ૫૫%

(ક) ૬૦%

(ડ) ૬૩%

સૂચના - પ્રશ્ન નં. ૨૭ થી ૩૦ માટે : શાળામાં સામાયિક પરીક્ષા દર બીજા મહિને થાય છે. એપ્રિલ ૨૦૦૧- માર્ચ ૨૦૦૨ દરમિયાન ધોરણ ૮ના વિદ્યાર્થી. દરેક સામાયિક પરીક્ષાઓ માટે પ્રસિદ્ધ કર્યું. દરેક સામાયિક પરીક્ષામાં તેમના દ્વારા મેળવવામાં આવેલ કુલ નીચે રેખાગ્રાફમાં રજુ થાય છે.

વર્ષ : ૨૦૦૧-૨૦૦૨ માં દર બે મહિનામાં છ આયોજિત યોજાયેલી વિદ્યાર્થી દ્વારા મેળવેલ ગુણ



દરેક સામાયિક પરીક્ષાની મહત્તમ સંખ્યા : ૫૦૦

૨૭. કયા સામાયિક પરીક્ષામાં વિદ્યાર્થીએ અગાઉના સામાયિક પરીક્ષાઓના ગુણમાં સૌથી વધુ ટકાવારી વધારો મેળવ્યો હતો?

(અ) જુન, ૦૧

(બ) ઓગષ્ટ, ૦૧

(ક) ઓક્ટોબર, ૦૧

(ડ) ડિસેમ્બર, ૦૧

૨૮. ૨ ફેબ્રુઆરીથી મેળવેલ ગુણની સંખ્યાએ એપ્રિલ ૧માં મેળવેલ કુલ ગુણ પૈકી ટકા શું છે?

(અ) ૧૧૦%

(બ) ૧૧૨.૫%

(ક) ૧૧૫%

(ડ) ૧૧૬.૫%

૨૯. ઓગષ્ટ ૦૧ અને ઓક્ટો. ૦૧ ની સામાયિક પરીક્ષામાં વિદ્યાર્થી દ્વારા મેળવેલ ગુણની ટકાવારી શું છે?

(અ) ૭૩.૨૫%

(બ) ૭૫.૫%

(ક) ૭૭%

(ડ) ૭૮.૭૫%

૩૦. છેલ્લા સત્ર દરમિયાન તમામ સામાયિક પરીક્ષાઓમાં વિદ્યાર્થી દ્વારા મેળવેલ સરેરાશ ગુણ શું છે?

(અ) ૩૭૩

(બ) ૩૭૮

(ક) ૩૮૧

(ડ) ૩૮૫

પ્રશ્ન નં ૩૧ થી ૩૫ માટે સૂચના : આપેલ શબ્દનો વિરોધી શબ્દ લખો.

૩૧. અસાવધાન
(અ) ભરોસાપાત્ર (બ) વફાદાર
(ક) સાવધ (ડ) મંદબુદ્ધિ
૩૨. પરીથિત [15]
(અ) અપ્રિય (બ) ભયજનક
(ક) મિત્રતાવાળુ (ડ) અપરિથિત
૩૩. વાસ્તવિક
(અ) અલૌકિક (બ) નિશ્ચિત
(ક) વર્તમાન (ડ) કઠણ
૩૪. પ્રેમ
(અ) દુષ્ટતા (બ) દ્વેષભાવ
(ક) જબરજસ્તી (ડ) દબાણ
૩૫. પ્રતિષ્ઠિત
(અ) કલંકિત (બ) અજાણ્યું
(ક) દુષ્ટ (ડ) જાણીતું

પ્રશ્ન નં. ૩૬ થી ૪૦ માટે સૂચના : આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.

૩૬. સ્તુતિ કરવી
(અ) સપાટ (બ) પડકાર
(ક) આરાધના (ડ) ચહેરો
૩૭. નિખાલસ
(અ) ઉઘાડુ (બ) સ્પષ્ટપણે
(ક) પ્રમાણિક (ડ) તેજસ્વી
૩૮. અસામાન્ય
(અ) કચારેય નહિ (બ) સામાન્યપણે બનતું
(ક) અસાધારણ (ડ) ઘણીવાર
૩૯. પ્રતિબંધ
(અ) અડચણ (બ) વિરોધ
(ક) અવરોધ (ડ) નિયંત્રણ
૪૦. પૂર્વગ્રહ
(અ) દૂત (બ) કારભ
(ક) આગામી ઘટનાનું સૂચક ચિત્ર (ડ) વિમાન ચાલક

પ્રશ્ન નં. ૪૧ થી ૪૫ માટે સૂચના : નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો.
જીવનનો હેતુ શું હોવો જોઈએ? નાણાં કે સિદ્ધાંતો? સારુ ભણેલાં, બુદ્ધિમાન કે નિર્ભય વ્યક્તિ માટે નાણાં કમાવવા તે તેમના વિચારનો મુખ્ય હેતુ છે. પરંતુ તે તેમની માટે અઘરું છે. તંદુરસ્ત માણસ તેમનું સાંજનું જમવાનું ગમે છે તેમાં કોઈ શંકા નથી પરંતુ એમાં પણ કોઈ શંકા નથી કે બધા તંદુરસ્ત મગજનાં વ્યક્તિઓને નાણાં કમાવવાનું ગમે છે. એમની પાસે હોય અને તે તેને જાળવી રાખી આનંદ માણે પણ નાણાં કરતાં પણ બીજું કંઈક સારું છે. ઉદાહરણ તરીકે ડોક્ટર, તેમને તેમની ફી ગમે છે. એમાં કોઈ શંકા નથી. હજી સુધી તે નિર્ભય અને સારુ ભણેલ તેમનાં જીવનનો સંપૂર્ણ હેતુ ફી નથી. સંપૂર્ણ તેઓની ઉપર હોય છે બીમાર વ્યક્તિની કાળજી ઈચ્છવી અને જો તે સારા ડોક્ટર હોય તો યોગ્ય પસંદગી કરવી તેમના હાથમાં જ હોય છે કે તેમના દર્દીની કાળજી લેવી અને ફી ને જતી કરવી નહીં તો દર્દીને મરણમાં લઈ જવું અને ફી પ્રાપ્ત કરવી. તેવી જ રીતે એક સારો સૈનિક તેની મૂલ્ય ઈચ્છા હોય

છે કે સારી લડત લડવી. તેને જે નાણાં ચુકવવામાં આવે છે તેમાં તે સંતુષ્ટ છે. છતાં તેનાં જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય લડાઈ જીતવાનો હોય છે. લડાઈ જીતવા માટે તેમને નાણાં આપવામાં આવતા નથી. તેવી જ રીતે પાસ્ટરનો મહત્વનો હેતુ બાપ્તિસ્મા આપવું અને સુવાર્તા આપવી. તેમને સુવાર્તા આપવા માટે નાણાં આપવામાં કે તેમના માટે તેમનું કાર્ય પ્રથમ અને નાણાં પછી આવે છે. જો કે અગત્યનાં છે, પરંતુ ગૌણ છે.

૪૧. સારું ભણેલા અને નિર્ભય બુદ્ધિમાન લોકોનો જીવનનો હેતુ કયો છે?
- (અ) નાણાં કમાવવા (બ) આનંદ માણવો
(ક) નિષ્ઠાથી કામ કરવું (ડ) મંદ હેતુઓનું સંચાલન કરવું
૪૨. આપેલા ફક્રા પ્રમાણે જો ડોક્ટર નિર્ભય અને સારું ભણેલો હોય અને પસંદગી તેના હાથમાં મુકવામાં આવી તો તેણે શું પસંદ કર્યું હશે?
- (અ) દર્દીની કાળજી લેવી અને ફી જતી કરવી (બ) દર્દીને મરણમાં લઈ જવું અને ફી પ્રાપ્ત કરવી
(ક) પરિસ્થિતિના આધારે કોઈપણ (ડ) આ બાબતે ફક્રો અબોલ છે.
૪૩. ફક્રાનું શિર્ષક હોઈ શકે -
- (અ) નાણા કમાવવા જીવનનો મુખ્ય હેતુ (બ) નિષ્ઠાથી કાર્ય કરવું
(ક) પિયારોનું મહત્વ (ડ) નાણાં જીવનનો મુખ્ય હેતુ નથી
૪૪. કોઈ એક ધારણા કરી શકાય ફક્રા માટે -
- (અ) નિર્ભય માણસને નાણા કમાવાનું ગમે
(બ) નિર્ભય માણસને બીજાને જીતવાનું ગમે
(ક) નિર્ભય માણસને પ્રથમ કાર્ય ત્યારબાદ ફી લેવી ગમે
(ડ) એક પણ નહિ
૪૫. કોઈપણ વ્યક્તિ તેનું કાર્ય નાણા કરતા હંમેશા ઉચ્ચ હારમાં રાખે જો તે વ્યક્તિ-
- (અ) નિર્ભય અને બુદ્ધિમાન (બ) સારું ભણેલો
(ક) યોગ્ય તાલીમ પ્રાપ્ત કરેલ (ડ) આપેલા તમામ